

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રીસર્ચ હોસ્પિટલ, અમદાવાદને સરકારી હોસ્પિટલ સમકક્ષ ગણવા બાબત.

ગુજરાત સરકાર
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,
ઠરાવ ક્રમાંક:- તસખ/૧૦૨૦૧૯/૧૭૩/અ.૧
સચિવાલય, ગાંધીનગર.
તારીખ :- ૧૭/૧૦/૨૦૧૯

વંચાણે લીધા:-

- (૧) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો તા.૨૪-૮-૨૦૧૫નો ઠરાવ ક્રમાંક:- એમએજી/૧૦૨૦૦૩/૨૭૧૨/અ (પા.ફા.)
- (૨) મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનનો તા.૨૯-૫-૨૦૧૯નો પત્ર.

આ મુ ખ :-

ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ/અધિકારીઓ/પેન્શનરો અને તેમના આશ્રિત કુટુંબીજનોને પ્રવર્તમાન ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો-૨૦૧૫ અન્વયે સરકારી હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ સમકક્ષ અને મા યોજનામાં એમ્પોનલ્ડ થયેલ હોસ્પિટલો ખાતે મેળવેલ તબીબી સારવારનું મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર થાય છે. જાન્યુઆરી-૨૦૧૯માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રીસર્ચ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં પાયાની તથા સુપર સ્પેશ્યાલીટીની સારવાર ઉપલબ્ધ છે. સદરહુ હોસ્પિટલમાં સારવાર લેતાં રાજ્ય સરકારના કર્મચારીઓ તથા પેન્શનરોને મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર થતું નથી. આથી આ હોસ્પિટલમાં સારવાર લેતાં તમામ કર્મચારીઓ તથા પેન્શનરોને મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર થાય તે હેતુસર ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો-૨૦૧૫ અંતર્ગત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રીસર્ચ હોસ્પિટલ, અમદાવાદને તબીબી સારવારના નિયમો, ૨૦૧૫ ના નિયમ-(૨.૪) મુજબ “સરકારી હોસ્પિટલ સમકક્ષ” ની માન્યતા આપવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

ઠ રા વ:-

કાળજીપૂર્વકની વિચારણાને અંતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રીસર્ચ હોસ્પિટલ, અમદાવાદને ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો-૨૦૧૫ના નિયમ-(૨.૪) અંતર્ગત સરકારી હોસ્પિટલ સમકક્ષ ગણવાનું આથી ઠરાવવામાં આવે છે અને રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ/ અધિકારીઓ/પેન્શનરો અને તેમના કુટુંબીજનોએ પ્રસ્તુત હોસ્પિટલ ખાતે લીઘેલ તબીબી સારવારનું મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર થશે.

૨) આ ઠરાવનો અમલ પ્રસિદ્ધ થયા તારીખથી કરવાનો રહેશે.

૩) તબીબી સારવારની મેડીકલ રીએમ્બર્સમેન્ટને લગતી અન્ય તમામ જોગવાઈઓ/શરતો આ વિભાગના તા.૨૪-૮-૨૦૧૫ના ઠરાવ અને ત્યારબાદ આ અંગે વખતોવખત બહાર પાડવામાં આવેલ ઠરાવોમાં દર્શાવ્યા મુજબની રહેશે.

૪) આ ઠરાવ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર માન.નાયબ મુખ્ય મંત્રીશ્રી (આરોગ્ય)ની તા.૯-૯-૨૦૧૯ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,



(આઇ.ડી.ચૌધરી)

ઉપસચિવ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

પ્રતિ,

- માન.રાજ્યપાલશ્રીના સચિવશ્રી, રાજભવન, ગાંધીનગર (પત્ર દ્વારા)
- માન.મુખ્ય મંત્રીશ્રીના અગ્રસચિવશ્રી, સ્વર્ણિમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગર.
- માન.મંત્રીશ્રીઓ/રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓના અંગતસચિવશ્રીઓ, સ્વર્ણિમ સંકુલ-૧-૨, સચિવાલય, ગાંધીનગર.
- અધિક મુખ્ય સચિવશ્રી, નાણાં વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
- અગ્રસચિવશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.

- અગ્રસચિવશ્રી, સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
- સચિવાલયના સર્વે વિભાગો.
- નાણાં સલાહકારશ્રી (આરોગ્ય) નાણાં વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
- રજીસ્ટ્રારશ્રી, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ. (પત્ર દ્વારા).
- સચિવશ્રી, ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગર (પત્ર દ્વારા)
- સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર (પત્ર દ્વારા)
- સચિવશ્રી, ગુજરાત વિધાનસભા, સચિવાલય, ગાંધીનગર.
- કમિશ્નરશ્રી, આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણ, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
- રેસીડેન્સ કમિશ્નરશ્રી, ગુજરાત ભવન, ન્યુ દિલ્હી.
- સર્વે કલેક્ટરશ્રીઓ.
- સર્વે જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ.
- સર્વે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ.
- સર્વે વિભાગીય નાયબ નિયામકશ્રીઓ.
- સર્વે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીઓ.
- સર્વે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી-સહ-સિવિલ સર્જનશ્રીઓ જનરલ હોસ્પિટલ.
- સર્વે અધિક્ષકશ્રીઓ સરકારી હોસ્પિટલ.
- સર્વે ડીનશ્રીઓ મેડીકલ કોલેજ તથા ડેન્ટલ કોલેજ (ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સહિત)
- સર્વે તબીબી અધિક્ષકશ્રીઓ સિવિલ હોસ્પિટલ, (ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સહિત)
- માહિતી કમિશ્નરશ્રી, ગાંધીનગર.
- ભાષા નિયામકશ્રી, ગાંધીનગર.
- સર્વે જિલ્લા રજીસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ.
- એકાઉન્ટન્ટ જનરલશ્રી, અમદાવાદ/રાજકોટ.
- નિયામકશ્રી, હિસાબ અને તિજોરી, ૧૭, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
- નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ડ ફંડ, ૧૮, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
- પગાર અને હિસાબી અધિકારીશ્રી, ગાંધીનગર/અમદાવાદ.
- નિયામકશ્રી ઓડિટ અધિકારીશ્રી, ગાંધીનગર/અમદાવાદ.
- સર્વે જિલ્લા તિજોરી અધિકારીશ્રીઓ.
- રાજ્યના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રોના અધિક્ષકશ્રીઓ.

- લાયજન ઓફીસરશ્રી, ગુજરાત સરકાર, ધનરાજ મહેલ, અપોલો બંદર, મુંબઈ- ૪૦૦૦૩૯.
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સર્વે શાખાઓ.
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના સર્વે ખાતાના વડાઓ.
- નાયબ સેક્શન અધિકારી સિલેક્ટ ફાઇલ
- સિલેક્ટ ફાઇલ.